



# Bhakta Kavi Narsinh Mehta University

Govt. Polytechnic College, Bhakta Kavi Narsinh Mehta University Road, Khadiya  
Junagadh, Gujarat (India)-362 263

Ph.(0)0285-2681400 / Fax : 0285-2681503

Website :<http://www.bknmu.edu.in>, Email :[registrar@bknmu.edu.in](mailto:registrar@bknmu.edu.in)

પરિપત્ર:-

વિષય:- ડિગ્રી પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ ભરવા બાબત.

આથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ભવન ના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રના પ્રોફેસર ઇન્ચાર્જશ્રીઓ, સંલગ્ન કોલેજના આચાર્યશ્રીઓ તથા માન્ય સંસ્થાઓના વડાઓને સવિનય જણાવવાનું કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફથી લેવામાં આવનાર જુદી-જુદી પદવી કક્ષાની ફાઇનલ પરીક્ષામાં બેસનાર હોય (GAPL સોફ્ટવેર અને NON CBCS સોફ્ટવેર અંતર્ગત) તેવા વિદ્યાર્થીઓના પરીક્ષાઓના આવેદનપત્ર સાથે ફરજિયાત પદવી ફોર્મ ભરાવવાના રહેશે.

૧. પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવાની જે તારીખ આપવામાં આવેલ હોય તે મુજબ પદવી ફોર્મ તથા ફી સ્વીકારવાની રહેશે.
  ૨. જે તે ડિગ્રી કક્ષાના પદવી ફોર્મ A TO Z સુધીના આલ્ફાબેટ અનુસાર ૧ થી ૧૦૦ ની ફાઇલ બનાવીને તેનું લીસ્ટ બે નકલમાં પરીક્ષા વિભાગને આપવાનું રહેશે. (પદવી ફોર્મ સાથે માર્કશીટ જોડવી ફરજિયાત નથી.)
  ૩. પદવી ફી હિસાબી વિભાગમાં જમા કર્યા બાદ ફી ની પહોંચ સાથે પરીક્ષા વિભાગમાં પદવી ફોર્મ જમા કરાવવાના રહેશે.
  ૪. વિદ્યાર્થીઓએ પદવી ફોર્મમાં જણાવ્યા મુજબની વિગતે પદવી ફોર્મ ભરવાનું રહેશે અને કાયમી એડ્રેસ દર્શાવવાનું રહેશે.
  ૫. ડિગ્રી કક્ષાની પરીક્ષાઓના પદવીનું આવેદન પત્રની સોફ્ટ કોપી (PDF FILE) યુનિવર્સિટીની વેબસાઇટ [www.bknmu.edu.in](http://www.bknmu.edu.in) પરથી ડાઉનલોડ કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
  ૬. નિયત થયેલી તારીખ બાદ પદવી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં
  ૭. ડિગ્રીનાં ફોર્મ પરીક્ષા ફોર્મની સાથે કોલેજ દ્વારા જ ઓનલાઇન ભરવા તેમજ વિદ્યાર્થી દ્વારા ડીગ્રી ફોર્મમાં જે સરનામું આપ્યું હોય તે પ્રમાણે ભરીને તેનો ફી મેમો જનરેટ કરીને પરીક્ષા વિભાગમાં ફી સાથે જમા કરવાની રહેશે.
  ૮. જે વિદ્યાર્થીઓ બી.એડ. તેમજ પી.જી., ડિપ્લોમા, પી.જી. ડિપ્લોમાં ની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેઓના ડિગ્રી ફોર્મ કોલેજ મારફત ભરવાનાં રહેશે. ( સોફ્ટવેર લેવલે ઓનલાઇન એન્ટ્રી કોલેજ મારફત કરવાની રહેશે.) આવા વિદ્યાર્થીઓએ દિન ૩૦ માં કોલેજમાં ફોર્મ ભરી દેવાના રહેશે ત્યારબાદ કોલેજ દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેની વિદ્યાર્થીઓએ ગંભિરતાપૂર્વક નોંધ લેવી.
  ૯. યુ.જી. સેમેસ્ટર- ૬ અને પી.જી. સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓને પરીક્ષા ફી રસીદ સાથે રૂ. ૨૫૦/- ઊમેરીને વિદ્યાર્થીને રસીદ આપવાની રહેશે, આ રસીદ વિદ્યાર્થીએ પદવીપત્ર ન મળે ત્યા સુધી સાચવીને રાખવાની તેમજ પદવીપત્ર મેળવતી વખતે યુનિવર્સિટીમાં આ રસીદ જમા કરાવવાની રહેશે જેની વિદ્યાર્થીઓ તેમજ કોલેજ તેમજ પી.જી. સેન્ટરનાં વડાઓએ ધ્યાનમાં લેવું.
- નોંધ:- જે વિદ્યાર્થીઓને અનુસ્નાતક કક્ષામાં સેમેસ્ટર ૧ થી ૩ તેમજ સ્નાતક કક્ષામાં ૧ થી ૫ સેમેસ્ટરમાં નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીએ પી.જી. સેમેસ્ટર ૪ અને યુ.જી. સેમેસ્ટર- ૬ ના પરીક્ષા ફોર્મ સાથે પદવી ફોર્મ ભરવાના રહેશે.
- નોંધ: ડીગ્રી ફોર્મની નિયત ફી રૂ. ૨૫૦/- લેખે રહેશે ( વિદ્યાર્થીઓ તેમજ આચાર્યશ્રીઓની રજૂઆતને આધારે માનનિય કુલપતિશ્રી દ્વારા ઉપરોક્ત ફી માં ઘટાડો કરવામાં આવેલ છે.

*Dr. Khadee*

પરીક્ષા નિયામક

ક્રમાંક: બીકેએનએમયુ/પરીક્ષા/૦૨/૫૯૨૫/૨૦૧૯

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજ કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડિયા, જુનાગઢ.

તા. ૧૫/૦૨/૨૦૧૯

પ્રતિ,

સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ પી.જી. સેન્ટરના વડાઓ તેમજ જુદી જુદી વિદ્યાશાખાનાં રેગ્યુલર તેમજ બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને જાણ સારૂ.

નકલ સાદર રવાના :

૧. માનનીય કુલપતિશ્રી/કુલસચિવશ્રી ના અંગત સચિવશ્રી
૨. આઇ.ટી. સેલ( વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવા અને યોગ્ય કાર્યવાહી અર્થે.)